

**PARUL UNIVERSITY**  
**FACULTY OF ENGINEERING & TECHNOLOGY**  
**Diploma Engineering MID semester Examination**

**Semester: 5<sup>th</sup>****Subject Code: 03602311****Subject Name: Utility and Instrumentation Control****Date: (10/08/2022)****Time: (1hr: 15min)****Total Marks: 40****Instructions:**

1. Attempt all questions.
2. Make suitable assumptions wherever necessary.
3. Figures to the right indicate full marks.
4. English version is considered to be Authentic.

<b>Q.1</b>	<b>Answer any six out of Ten. (2 Marks Each)</b>	<b>(12)</b>
	1. What is utility? Give Name any four utilities.	
	2. What is Instrumentation? What are their types?	
	3. Differentiate dynamic and static characteristics.	
	4. List out the sources of water.	
	5. Write the importance of utility.	
	6. Define Hard & soft water.	
	7. Define: Speed of response, Accuracy.	
	8. Define coagulation. And also write the application.	
	9. What is boiler feed water? And write the application.	
	10. Define: Sterilization, sedimentation.	
<b>Q.2</b>	A) Classified instrumentation and write the pressure measurement.	<b>(03)</b>
	<b>OR</b>	
	A) What are static characteristics? And explain point accuracy, sensitivity, and reproducibility.	<b>(03)</b>
	B) What is the basic element of instrumentation? And also explain any one in details.	<b>(03)</b>
	<b>OR</b>	
	B) Explain briefly data presenting element or functioning element.	<b>(03)</b>
	C) Classified sources of water and explain any one in details.	<b>(04)</b>
	<b>OR</b>	
	C) Differentiate hard and soft water.	<b>(04)</b>
	D) List out the water softening methods and explain zeolite process with figure.	<b>(04)</b>
<b>Q.3</b>	A) What is the dynamic characteristic? Define: Measuring lag, fidelity, and dynamic error.	<b>(03)</b>
	<b>OR</b>	
	A) Define: Resolution, Threshold, Range or Span.	<b>(03)</b>
	B) List out the water purification methods and explain sedimentation with figure.	<b>(03)</b>
	<b>OR</b>	
	B) List out the water purification methods and explain filtration with figure.	<b>(03)</b>
	C) Methods of water softening processes, and explain Ion-exchange process with figure.	<b>(04)</b>
	<b>OR</b>	
	C) Methods of water softening processes, and explain hot soda lime process with figure.	<b>(04)</b>
	D) Explain in brief on sterilization with figure.	<b>(04)</b>

## ગુજરાતી

<b>પ્રશ્ન.૧</b>	દસમાંથી કોઈપણ છ જવાબ આપો.(દરેક માટે ૨ ગુણા)	(૧૮)
	૧. યુટીલિટી એવી એવી હોય? એવીએવી એવી એવી એવી એવી.	
	૨. એવીએવીએવીએવીએવીએવી એવી એવી? એવીએવીએવીએવીએવી એવી એવી?	
	૩. એવીએવી એવી એવીએવીએવીએવી એવી એવી.	
	૪. એવીએવીએવીએવીએવીએવી એવી એવીએવી.	
	૫. એવીએવીએવીએવીએવીએવી એવી.	
	૬. એવી એવી એવી એવીએવીએવીએવી એવી.	
	૭. એવીએવીએવીએવી એવી: એવીએવીએવીએવી એવી, એવીએવી.	
	૮. એવીએવીએવીએવી એવીએવીએવીએવી એવી. એવી એવીએવીએવીએવી એવી એવી.	
	૯. એવીએવીએવીએવી એવી? એવી એવીએવીએવીએવી એવી.	
	૧૦ એવીએવીએવીએવી એવી: એવીએવીએવીએવીએવી, એવીએવીએવીએવી.	
<b>પ્રશ્ન.૨</b>	એ) એવીએવીએવીએવીએવીએવીએવીએવી એવી એવીએવી એવી.	(૦૩)
	<b>અથવા</b>	
	એ) એવીએવી એવીએવીએવીએવી એવી એવી? એવી એવીએવી એવીએવીએવીએવી, એવીએવીએવીએવીએવીએવી એવીએવી.	(૦૩)
	બી) એવીએવીએવીએવીએવીએવીએવી એવીએવી એવીએવીએવી એવી એવી? એવી એવીએવી એવીએવી એવી એવીએવીએવીએવી.	(૦૩)
	<b>અથવા</b>	
	બી) એવીએવીએવીએવી એવીએવી એવીએવીએવીએવી એવી એવીએવીએવી એવીએવી.	(૦૩)
	સી) એવીએવી એવીએવીએવીએવી એવી એવીએવી એવીએવીએવી એવીએવી.	(૦૪)
	<b>અથવા</b>	
	સી) એવી એવી એવી એવીએવી એવી.	(૦૪)
	ડી) એવીએવી એવી એવીએવીએવી એવી એવીએવી એવી એવીએવીએવી એવીએવીએવી.	(૦૪)
<b>પ્રશ્ન.૩</b>	એ) એવીએવીએવી એવીએવીએવી એવી એવી? એવીએવીએવી એવી: એવીએવીએવી એવી, એવીએવીએવી એવી એવીએવીએવી એવી.	(૦૩)
	<b>અથવા</b>	
	એ) એવીએવીએવીએવી એવી: એવીએવીએવી, એવીએવીએવી, એવીએવી એવીએવી.	(૦૩)
	બી) એવીએવીએવીએવી એવીએવીએવી એવી એવીએવી એવી એવીએવીએવીએવી એવીએવી.	(૦૩)
	<b>અથવા</b>	

	બી) માર્ગ માર્ગનામણ માર્ગનામણ માર્ગ માર્ગ માર્ગ માર્ગ માર્ગ માર્ગ.	(૦૩)
	સી) માર્ગનામણ માર્ગ માર્ગનામણ માર્ગનામણ માર્ગ માર્ગ -નામણ નામણ નામણનામણ નામણ નામણ.	(૦૪)
	<b>અથવા</b>	
	સી) માર્ગનામણ માર્ગ માર્ગનામણ માર્ગનામણ, માર્ગ માર્ગ માર્ગ માર્ગ માર્ગ માર્ગનામણ નામણ.	(૦૪)
	ડી) માર્ગ માર્ગ માર્ગનામણ માર્ગ માર્ગનામણ નામણ.	(૦૪)